

સાસણીય ફર્મચા-યાંગા સ્વામી જાણ્યાસાઠી

પ્રવાસ સવલત - -

બાસન/સાયબાળ બાઈયાં પ્રતિપૂર્તી.

મહાયાદુર થાલબ

ખિત્ત વિભાગ,

સાસન પારિપત્રક ક્રમાંક ટીઓએ-૧૧૮૦/સીડાર-૫૭૭/૮૧/એસેઝાર-૫,
મંત્રાલય, મુખ્ય ૪૦૦ ૦૩૨, દિલ્હી ૧૬ એપ્રિલ ૧૯૮૨.

પારિપત્રક

સાસન વિર્જિય, ખિત્ત વિભાગ ક્રમાંક ટીઓએ-૧૧૮૦/સીડાર-૩૧૮/એસેઝાર-૫, દિલ્હી
૯ સાલ્ટેન્ટર ૧૯૮૦ યાન્યાં સાસનાબે સ્વામી જાણ્યાસાઠી પ્રવાસ સવલત યોજનેત સુધ્યાણ ફેલ્યા
આહેત. સદર નિર્જયાદ્વારે સાસણીય ફર્મચારી વ ત્યાંથી ફુલ્દું બીંગ યાંગા સ્વામી જાણ્યાસાઠી સાસણીય
આર્થિક સહાય્યાદી મર્યાદા રાખ્યાંતરી સંપૂર્ણ ૨૦૦ ટઙ્કે વ ચાર્યા સીમેપલિફે પણ ૪૦૦ ફિલોમિટર
ગંતરાપર્યક્તથા પ્રવાસસાઠી સંપૂર્ણ પ્રવાસ-માઝાહતફે ઉપલબ્ધ જાહે. તથાપિ સ્વામી જાણ્યાસાઠી
પ્રવાસ સયતતીચ્યા યા યોજનોત્તરી પ્રવાસસાઠી ફેલેલ્યા બાસન/બાઈયાં એસેઝાર
ફર્મચારી ફા બસા જનેઠદા પ્રષ્ટા ઉપણિત ફેલા જાતો.

સુસફુદ્ય પ્રવાસાચ્યા દુષ્ટીને પ્રવાસપૂર્વ બાસન જારલાણ ઠી જાણચી ગુણ્યાવસ્થણ બાબુ ઠરાલી જાહે.
ખલ્યેચ્યા પ્રયગ વર્ગાંચા પ્રવાસ ઊરાન જારલાણાશિવાય ફરતા, યેત બાંધી વ દુરદરાચ્યા દુસ-યા દર્શિયા
પ્રવાયાસાઠી ઉપલબ્ધ બસતેલી જાયગાબાદી, શુદ્ધિચા જારલાણાશિવાય ઉપમેળતા, યેત બાંધી. જારલાણાઠી
ઠી જાહ યંત્રિણ ગરજ કૃષ્ણાત ધેઠન સાસનાબે સાસણીય ફર્મચા-યાંગા દોચાંચે ચમયી પ્રવાસ ફેલા
ગ્રસ્તાગા તસેચ ત્યાંચ્યા સ્થાનાંતરણ પ્રસંગીચ્યા પ્રવાસસાઠીઠી બાસન જારલાણાદી પ્રતિપૂર્તી જબુદૈય
ઠરવિલી જાહે. દ્વારા જાતીયર સાસન બસે સ્પષ્ટ કરીત જાહે ઠી, સ્વામી જાણ્યાસાઠીચ્યા વ તેથુન
પરતણાસાઠીચ્યા પ્રવાસસાઠી ફેલેલ્યા જારલાણાચ્યા બર્ચાંચી સંપૂર્ણ પ્રતિપૂર્તી, પ્રવાસ સવલતીસગવેત
જબુદૈય છાંચી.

યા જાદેશાબુસાર પ્રલંબિત પ્રફરણાંચી ય જાદા ન જાતિલી દેયફે નિયમિત ફરાપાત પાયીત.
માત્ર જાદા જ્ઞાલેલ્યા દેયફાંચા પુર્યિયાર હોંક કાયે.

યા પારિપત્રકાંચી હંગામી પ્રત પોચત જોડતી જાહે.

મહાયાદુરાંચે રાજ્યપાત યાંચા જાદેશાબુસારાંચ, નાંદાંચ,

મો. ગ. પી,

સાસનાંચે ઉપ સચિય.

પ્રતિ

મહાલિંગાપાત, મહાયાદુર ?, મુખ્ય,

મહાલિંગાપાત, મહાયાદુર ૨, બાગ્યુર,

અધિકારી ય લેધા અધિકારી, મુખ્ય (મહાયાદુર ચાચ્ય),